



# GOVT. MEDICAL COLLEGE - BHAVNAGAR

Near S. T. Stand, Jail Road,  
Bhavnagar - 364 002. (Gujarat-India)

Tel. : (0278) 2422011 / 2430808 / 2431855 / 2431866 Fax : (0278) 2422011




NO.MCB/S.S./2020/20

Date : 22 / 05 / 2020

## નોટીસ:

વિષય:- પી.જી. એડમીશન-૨૦૧૭ માટે ભાવનગર યુનિવર્સિટીમાં ભરેલ એડમીશન ફોર્મ-ફિ પરત આપવા બાબત.

આથી જાણાવવાનું કે અત્રેની સંસ્થામાં પોસ્ટ ગ્રેજ્યુએટ એડમીશન-૨૦૧૭ માટે ભાવનગર યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન પ્રવેશ ફોર્મ/ફિ ભરાવવામાં આવેલ હતી. ત્યારબાદ એમ.સી.આઈ ના નિયમથી સેન્ટ્રલ એડમીશન કમીટી (ACPPGMC) દ્વારા રાજ્ય સ્તરેથી પ્રવેશ કાર્યવાહી કરવામાં આવતા અત્રેથી યુનિવર્સિટી સ્તરેથી કરવામાં આવેલ પ્રવેશ કાર્યવાહી રદ કરવામાં આવેલ હતી. આથી અત્રેથી યુનિવર્સિટીની વેબસાઈટ પર પી.જી. પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટર થયેલ ફોર્મની ફિ તમામ વિદ્યાર્થીઓને પરત આપવાની થાય છે. આથી આવા વિદ્યાર્થીઓ પાસેથી આ સાથે સામેલ નિયત નમુના પત્રક મુજબની ફિ-રીફંડ માટેની અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીએ આ અરજી ફોર્મ સંસ્થાની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી ભરવાનું રહેશે તથા યોગ્ય આધારો સાથે તા.૦૩-૦૬-૨૦૧૭ સુધીમાં અત્રેની કચેરીને પહોંચાડવા જાણાવવામાં આવે છે.

  
ડિરેક્ટર  
સરકારી મેડીકલ કોલેજ  
ભાવનગર

નકલ રવાના:

- (૧) ચીફ લાઈબ્રેરીયન, લાઈબ્રેરી, સરકારી મેડીકલ કોલેજ, ભાવનગર તરફ જાણ તથા નોટીસ બોર્ડ પર મુકવા સારૂ.
- (૨) હોસ્ટેલ સુપ્રીન્ટેન્ડેન્ટ, હોસ્ટેલ શાખા, સરકારી મેડીકલ કોલેજ, ભાવનગર તરફ જાણ તથા તમામ નોટીસ બોર્ડ પર મુકવા સારૂ.
- (૩) કચેરી નોટીસ બોર્ડ.

## APPLICATION FOR POST GRADUATE ADMISSION FORM FEE REFUND

NAME \_\_\_\_\_

ADDRESS \_\_\_\_\_

\_\_\_\_\_

MOBILE NO. \_\_\_\_\_

EMAIL ID. \_\_\_\_\_

DATE. \_\_\_\_\_

### TO

Chairman  
P.G. Admission Committee  
Govt. Medical College,  
Bhavnagar.

**Subject :** Regarding fee refund of Post Graduate admission form for Maharaja  
Krishnakumarsinhji Bhavnagar university, Bhavnagar-2017

Dear Sir,

I had submitted my online Post Graduate admission form on Maharaja Krishnakumarsinhji Bhavnagar university, Bhavnagar's website with confirm Registration no.\_\_\_\_\_. At that time I Pay online admission form fee (Receipt attached here with). After the MCI norms the admission process was conducted by central admission committee (ACPPGME) under Govt. of Gujarat. So I request you to please refund my Post Graduate admission form fee. My account details is as below.

Name of Candidate (In Capital Letters) (As per Bank A/c.)	
Bank Name	
Branch Name	
Bank Account No.	
IFSC Code	
Mobile No.	
Email ID	

I agree that minimum handling expense incurred of approx 30 % will be deducted from fee paid by me

Enclosed : (1) Self Attested Copy of Bank Passbook .  
(2) Self Attested Copy of fee receipt.

\_\_\_\_\_  
(Candidate Signature)

Candidate Name \_\_\_\_\_